

ફી અને શુલ્કની સમયસૂચિ	
વિવરણ	ફી/ શુલ્ક
પ્રક્રિયા ફી (નોન-રિફંડેબલ)	લોનની રકમના 4% સુધી અથવા રૂ. 18,000/-માંથી જે પણ ઉચ્ચ હોય
વિલંબિત ચુકવણી દંડ શુલ્ક	ચુકવણી ચડત હોય તે દિવસોની વાસ્તવિક સંખ્યા માટે માસિક ચડત રકમ પર 2%
હપ્તો બાઉન્સ થવાનું શુલ્ક	બાઉન્સ દીઠ રૂ. 1000/- સુધી
વાર્ષિક અકાઉન્ટ નિવેદન/ પુનઃ ચુકવણી સમયસૂચિ/ પ્રોવિઝનલ ટેક્સ સર્ટિફિકેટ/ એલઓડી ફોરકલોઝર પત્ર/ આવકાર પત્ર	- દરેક મહિને એક વાર જારી કરવા માટે શૂન્ય - ત્યાર બાદ/ ડુપ્લિકેટ માટે વિનંતી- દસ્તાવેજ દીઠ રૂ. 500/-
લોન રદ કરવાનો શુલ્ક	રૂ. 5000/- ઉપરાંત વ્યાજ લોનનું વિતરણ કરવાની તારીખ અને લોન રદ કરેલી તારીખ વચ્ચેના વચગાળાના સમય માટે લાગુ કરાશે. બેલેન્સ ટ્રાન્સફરના કિસ્સામાં ચૂકવવામાં આવેલી પ્રક્રિયા ફી રિફંડ નહીં કરાશે.
દસ્તાવેજ રિટ્રાઈવલ શુલ્ક	રિટ્રાઈવલ દીઠ રૂ. 1000/-
એડહોક નિવેદન જારી શુલ્ક	દસ્તાવેજ દીઠ રૂ. 500/-
સ્ટેમ્પ ડ્યુટી અને અન્ય કાનૂની દસ્તાવેજ શુલ્ક	વાસ્તવિકે રાજ્યના કાયદા અનુસાર લાગુ
વિતરણ પછાત દસ્તાવેજ શરતનું પાલન નહીં કરવા પર અથવા અહીં વિશિષ્ટ રીતે ઉલ્લેખ નહીં કર્યો હોય તેવા કોઈ અન્ય ભૌતિક નિયમો અથવા કોવેનન્ટ્સના ભંગ પર દંડનીય શુલ્ક	A) રૂ. 10 લાખ સુધી લોન- લોનની રકમના વાર્ષિક 1%, મહત્તમ રૂ. 10,000/-ને આધીન. B) રૂ. 10 લાખથી વધુ લોન- લોનની રકમના વાર્ષિક 1%, મહત્તમ રૂ. 25,000/-ને આધીન.
ચેક/ સાધન સ્વેપ શુલ્ક	☐ કિસ્સા દીઠ રૂ. 500/-
અન્ય દસ્તાવેજીકરણ શુલ્ક	☐ રૂ. 500/-

પૂર્વ-યુકવણી/ આંશિક પૂર્વ-યુકવણી/ ફોરક્લોઝર માટે શુલ્ક અને લાગુ શરતો	1. ફિક્સ્ડ રેટની લોન માટે: A. 12 ઈએમઆઈની સેવા પૂર્વે પૂર્વ-યુકવણી/ આંશિક પૂર્વ-યુકવણી* મંજૂર નથી. B. 12 ઈએમઆઈની સેવા પછી પૂર્વ-યુકવણી/ આંશિક પૂર્વ-યુકવણી*: મૂળ બાકી રકમ/ પૂર્વયુકવણી કરેલી રકમના 6% સુધી પૂર્વ-યુકવણી શુલ્ક. <u>પૂર્વ-યુકવણીની શરત(તો):</u> *મૂળ બાકી રકમના મહત્તમ 25% સુધી દરેક 12 (બાર) મહિનામાં એક વાર પૂર્વયુકવણી કરી શકાશે. 2. ફ્લોટિંગ રેટની લોન માટે: A. વેપાર સિવાયના હેતુ માટે વ્યક્તિગત ઋણદારો માટે: પૂર્વ-યુકવણી શુલ્ક: શૂન્ય. B. વ્યક્તિગતો અથવા માઈક્રો અને સ્મોલ એન્ટરપ્રાઈઝીસ દ્વારા રૂ. 50 લાખ સુધી ઉપલબ્ધ લોન માટે, જે વેપારના હેતુથી 1લી જાન્યુઆરી, 2026ના રોજ અથવા પછી મંજૂર કરાઈ હોય: પૂર્વ-યુકવણી શુલ્ક- શૂન્ય C. ઉક્ત 2. A અને 2. Bમાં આવરી લીધી હોય તે સિવાયની લોન માટે: (i) 12 ઈએમઆઈની સેવા પૂર્વે પૂર્વ-યુકવણી/ આંશિક પૂર્વ-યુકવણી* મંજૂર નથી. (ii) 12 ઈએમઆઈની સેવા પછી પૂર્વ-યુકવણી/ આંશિક પૂર્વ-યુકવણી*: મૂળ બાકી રકમ/ પૂર્વયુકવણી કરેલી રકમના 6% સુધી પૂર્વ-યુકવણી શુલ્ક. <u>પૂર્વ-યુકવણીની શરત(તો):</u> *મૂળ બાકી રકમના મહત્તમ 25% સુધી દરેક 12 (બાર) મહિનામાં એક વાર પૂર્વયુકવણી કરી શકાશે.
સ્વિચ કરવાના શુલ્ક (ફ્લોટિંગ વ્યાજ દરમાંથી ફિક્સ્ડ વ્યાજ દરમાં ફેરવવું)	રૂ. 10,000/-
વસૂલી- કાનૂની અને અન્ય ઘટનાત્મક શુલ્ક	વાસ્તવિક રીતે

નોંધ:

a) ઉક્ત ફી અને શુલ્કનું નિવેદન વિતરણની તારીખના રોજનું છે અને સમયાંતરે ફેરફાર/ સુધારણાને આધીન છે

અને સમયાંતરે વેબસાઈટ પર અપડેટ કરાશે (www.hfs.in).

- b) ઉક્ત સર્વ ફ્રી અને શુલ્કમાં કરો સમાવિષ્ટ નથી અને કર લાગુ કાયદા અનુસાર વસૂલ કરાશે.
- c) ઉક્તમાં કોઈ પણ અપવાદ એચએફએસની એકમેવ મરજીથી રહેશે.